

July 14, 2020

To,
The Manager
Dept. of Corporate Services
BSE Ltd.
25th Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai - 400001

Sub: Advertisement in Newspapers under Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015.

Ref: Shahlon Silk Industries Ltd. (BSE Script Code: 542862)

Dear Sir,

With regard to subject, we attached herewith Newspaper Cutting for the advertisement published in 'Gujarat Guardian' and 'The Financial Express' publication dated 13/07/2020 in the matter of **Publication of Audited Financial Results** for the quarter and year ended on 31/03/2020.

Kindly update this information on your website for investors/general public.

Thanking you.

For, Shahlon Silk Industries Limited



Hitesh K. Garmora
Company Secretary

भारतीय कंटेनर निगम लिमिटेड
CONCOR
CONTAINER CORPORATION OF INDIA LTD.
 (An Navratna Company of Govt. of India)
CONCOR Annexa, NSIC MDBP Building (3rd Floor) Okhla Industrial Estate, New Delhi-110020

Tender Notice (E-TENDERING MODE ONLY)

Tender No. (CON/IT/2020/001)

Name of Work Open Tender in Two Bid System On-premise turnkey based Supply, Installation, Commissioning and Implementation of Hardware, Software, Licenses and Network along with one-year warranty and post warranty AMC and ATS support for one-year for setting up Disaster Recovery Site at Milhan, Nagpur

Estimated Cost Rs. 89,53,34,885.41/-

Completion Period 180 Days (period for supply, installation, implementation, commissioning, installation, migration, testing, acceptance and one-month successful run), one-year warranty, first year ATS and one-year AMC & ATS.

Earnest Money Deposit Rs. 10.00/- Lac (Ten Lac only) through e-Payment.

Cost of Document Rs. 1,000.00/- inclusive of all taxes and duties through e-payment.

Tender Processing Fee Rs. 4,500.00/- plus taxes as applicable. (Non-refundable) through e-payment.

Date of Sale (Online) From 13/07/2020 11:00 hrs. to 12/08/2020 (up-to 1600 hrs.)

Pre-Bid Meeting 23/07/2020 at 15:00 hrs.

Date & Time of submission of tender 13/08/2020 upto 12:00 hrs.

Date & Time of opening of tender 14/08/2020 at 11:30 hrs.

For financial eligibility criteria, experience with similar nature of work, etc., please refer to detailed tender notice available on website www.concorindia.com, but the complete tender document can be downloaded from website www.tenderwizard.com. Further, Contingendum/ Addendum to this Tender, if any, will be published on website www.concorindia.com, www.tenderwizard.com and Central Procurement Portal (CPP) only. Newspaper press advertisement shall not be issued for the same. **Executive Director (MIS)**

NRB INDUSTRIAL BEARINGS LIMITED
 CIN: L29253MH2011PLC213963
Regd. Office: 2nd Floor, Dhannur, 15, Sir P. M. Road, Fort, Mumbai - 400 001 Tel.: 022-2270 4206 Fax No.: 022-2270 4207
 Email: investorcare@nrb.in Web site: www.nrbindustrialbearings.com

NOTICE TO THE SHAREHOLDERS OF 9th ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 9th Annual General Meeting ("AGM") of the Members of the Company will be held on **Tuesday, 4th August, 2020 at 2:00 p.m.** through Video Conference ("VC")/ Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of AGM. The Company has sent email of the Annual Report along with AGM Notice convening AGM on 12th July, 2020, through electronic mode to the Members whose email addresses are registered with the Company and/or Depositories in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5th May, 2020 read with its circulars dated 12th April, 2020 and 13th April, 2020 and Securities and Exchange Board of India circular dated 12th May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.nrbindustrialbearings.com and Notice of AGM is also available on website of Central Depository Services (India) Limited (CDSL) at www.cdslindia.com.

Notice is also hereby given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 ("Act") and the applicable rules framed thereunder that the Registrar of Members and Share Transfer Books of the Company will remain closed on **Wednesday, 29th July, 2020 to Tuesday, 4th August, 2020** (both days inclusive) for the purpose of 9th AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Members are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notice convening the AGM using electronic voting system (e-voting) provided by CDSL. The voting rights of the Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on **Tuesday, 28th July, 2020 ("cut-off date")**.

The remote e-voting period commences on **Saturday, 1st August, 2020 at 10:00 a.m. and end on Monday, 3rd August, 2020 at 5:00 p.m.** During this period members of the Company, may cast their vote electronically on the business set forth in the Notice. The e-voting module shall be disabled for voting thereafter. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend / participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as on the cut-off date, may obtain the log in ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she already registered with the CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the e-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Nitin Kunder (022-23058738) or Mr. Mehboob Lakhani (022-23058543) or Mr. Rakesh Dalvi (022-23058542).

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, (CDSL), Central Depository Services (India) Limited, A/Wing, 25th Floor, Marathon Futrex, Mafatal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022-23058542/43.

The details of the AGM are available on the website of the Company at www.nrbindustrialbearings.com, CDSL, at www.evotingindia.com, BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com.

For NRB Industrial Bearings Limited
 Sd/-
Ratika Gandhi
 Company Secretary and Compliance Officer
 (ACS: 29732)

Date: 13th July, 2020
 Place: Mumbai

YES BANK Regd. & Corporate Office:
 YES Bank Tower, IFC-2, 15th Floor, Senapati Bapat Marg, Elphinstone (W), Mumbai-400 013.
 CIN: L65190MH2003PLC143249, Email: communications@yesbank.in, Website: www.yesbank.in

POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY

Whereas, The undersigned being the authorised officer of YES Bank Limited ("Bank") under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("Act") and in exercise of powers conferred under section 13(12) of the Act read with Rule 9 of the Security Interest (Enforcement) Rules 2002, had issued a demand notice dated mentioned below calling upon to repay the amount mentioned in the notice being below mentioned amount within 60 days from the date of receipt of the said notice.

The Borrower / security providers having failed to repay the amount, notice is hereby given to the Borrower/ security providers and to the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules.

The Borrower / security providers in particular and the public in general is hereby cautioned not to deal with the property mentioned below and any dealings with the said property will be subject to the charge of the Bank for below mentioned amount, together with all the other amounts outstanding including the costs, charges, expenses and interest thereon.

Please note that under Section 13 (8) of the aforesaid Act, in case our dues together with all costs, charges and expenses incurred by us are tendered at any time before the date fixed for sale or transfer, the secured asset shall not be sold or transferred by us, and no further step shall not be sold or transferred by us, and no further step shall be taken by us for transfer or sale of that secured asset.

DETAILS OF THE IMMOVABLE PROPERTY

S. No.	Name & Address of Borrower, Mortgagor & Co-Borrower	Description of the Mortgaged Properties	Total Outstanding Dues Rs.	Date of Demand/Notice Date & Type of Possession
1.	Mr. Narendrapat Barhate (the Borrower And Mortgagor) And Mrs. Bharati Narendrabharate (Co-Borrower and Mortgagor)	All the piece and parcel of the Flat No 111th & 12th, 2nd & 3rd Floor, Gandhari Co Op Housing Society Ltd, CTS No. 56, Final Pit No. 85, Erandwane Pune.	Rs. 2,38,58,828.50 /- (Rs. Two Crore Thirty-Eight Lacs Fifty-Eight Thousand Eight Hundred Twenty-Eight Rupees and Fifty Paise Only)	02.12.2019 08.07.2020 Symbolic possession
2.	Mrs. Sarita Tanaji Mane (the Borrower And Mortgagor) And Mrs. Mohini Tanaji Mane (Co-Borrower and Mortgagor)	All the piece and parcel of the Residential Flat No D-201, "Utsav Residency" Gat No- 695/2, At Koregaon, Bhim, Taluka- Shirur, Dist- Pune	Rs. 13, 37, 561.00 /- (Rs. Thirteen Lacs, Thirty Seven Thousand Five Hundred Sixty One only)	02.12.2019 08.07.2020 Symbolic possession
3.	Mr. Suryaprakash Vishwakarma , (the Borrower and Mortgagor) And Mrs. Swarnalata Vishwakarma (Co-Borrower and Mortgagor)	All the piece and parcel of the Residential Flat No D-205, 2nd Floor, Situated at GAT No. 160/ 1A(P)and 160 1B(P) Digrajwadi, Taluka Shirur, Dist- Pune	Rs. 09, 76, 431.80 /- (Rs. Nine Lacs, Seventy Six Thousand Four Hundred Thirty One and Eighty Paise only)	02.12.2019 08.07.2020 Symbolic possession

Place : Pune
 Date : 08.07.2020
 Sd/- (Authorized Officer)
Yes Bank Limited

NOTICE FOR LOSS OF SHARE CERTIFICATE

Minkashi Jha and Girija Shankar Jha residing at B-19/122, Associated Society, near Akota Garden, Akota Vadodara - 390020, shareholder of Housing Development Finance Corporation Limited (HDFC) hereby give notice that the original share certificate no. 10321 bearing distinctive nos. 13784736 to 13786735 for 2000 equity shares of F.V. R.2 under folio no. M0044586 issued to us by HDFC, has lost by me and we are giving an application to HDFC for issuance of duplicate share certificate in lieu thereof.

Any person, who is in possession of said share certificate and / or has any objection to the issue of the duplicate share certificate as aforesaid, is requested to contact HDFC Limited, Investor Services Department, Ramon House, 5th Floor, H.T. Parekh Marg, 169 Backbay Reclamation, Churhatge, Mumbai-400 020, within SEVEN (7) days from the date of this Notice, failing which HDFC will proceed to issue duplicate share certificate, in accordance with the Companies (Issuance of Share Certificate) Rules, 1960.

Sd/-
 Place : Vadodara (Minkashi Jha and Girija Shankar Jha)
 Date : 10.07.2020

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P.) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

FORM NO. URC-2
Advertisement giving notice about registration under Part I of Chapter XXI of the Companies Act, 2013 and rule 4(1) of the Companies (Authorised to Register) Rules, 2014

[Pursuant to Section 374 (b) of the Companies Act, 2013 and rule 4(1) of the Companies (Authorised to Register) Rules, 2014]

Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is proposed to be made after fifteen days hereof but before the expiry of thirty days hereinafter to the Registrar of Companies, Central Registration Centre, the Ministry of Corporate Affairs that a LLP GOYAL CONSTRUCTIONS AND PROJECTS LLP [LLPIN : AAP-0080] may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.

The Principal objects of the company are as follows:
 To carry on in India or elsewhere the business as contractors , builders, developers, executors, constructions of building, house, apartment and to build , layout, develop, construct, build, erect, demolish, re-erect, alter, repair or do any other work in connection with any building scheme, roads, high-ways, buildings, bridges, flats, houses, garages, factories, shops, establishments, hotels, resorts, offices, warehouses, shopping malls, theaters or otherwise deal in all kind of infrastructure development, property, house, land in both Commercial and residential projects property.

A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at **101, 10TH FLOOR, COMMERCE HOUSE IV, 100FT ROAD, NEAR RELIANCE PETROL PUMP, PRAHALADNAGAR AHMEDABAD - 380015 , GUJARAT, INDIA**

Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6, 7, 8, Sector 5, IMT Manesar, District Gurgaon (Haryana), Pin Code-122050, within twenty one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Dated this 11th day of July, 2020

Name(s) of Applicant
FOR GOYAL CONSTRUCTIONS AND PROJECTS LLP
 Sd/-
Mukesh Agarwal
 DIN : 00195552
 Designated Partner

Sd/-
Sandeep Agarwal
 DIN : 00195644
 Designated Partner

PRERANA
CO-OP BANK LTD.

Head Office : Laxman nagar, Dange Chowk, Thergaon, Pune 411033. Phone No. : 9075028001/02.
 Web site : www.preranabank.com, Email: Preranabankho@preranabank.com

POSSESSION NOTICE

WHEREAS, Shri. Meghanand Sadashiv Bodas, Authorized officer of Prerana Co-Op Bank Ltd. under Secritisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of power and conferred u/s 13 (2) of said Act read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice 21/12/2019 u/s 13 (2) of the said Act, calling upon the borrower M/s. Shri Sai Krupa Industries Prop. Shri. Gunjal Machindra Namdo residing at Gat No.1193, Santkrupa Colony, Sonawane Vasti, Chikhali, Pune 412114, to repay the amount mentioned in the said notice being Rupees 14,38,175.02 (Rupees Fourteen Lakh Thirty Eight Thousand One Hundred Seventy Five & Ps. Two Only) as on 30/11/2019 with future interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, cost and charges etc. incurred thereon from dated 01/12/2019 onwards until the date of payment within 60 days from the date of said notice.

The borrower and the others mentioned herein above have failed to repay the said amount and therefore the notice is hereby given to the borrower and others mentioned above in particular and to the public in general that the undersigned authorized officer is taking a possession of the property described in schedule below on 20/07/2020 in exercise of powers conferred on him under section 13 (4) of the said Act/R/w Rule 8 of the said rules.

The borrower and others mentioned above in particular and public in general are hereby cautioned not to deal with the property described herein below in any manner whatsoever and the dealings with the said property shall be subject to the charge of Prerana Co-Op Bank Ltd for Rs.15,82,170.34 (Rupees Fifteen Lakh Eighty Two Thousand One Hundred Seventy Ps. Thirty Four Only) as on 30/06/2020 with future interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, cost and charges etc. incurred thereon from 01/07/2020 onwards until the date of payment.

Mortgage Deed - Joint sub Registrar Haveli No.25., Dt. 25.02.2015 Document No. 1229/2015

SCHEDULE OF PROPERTY : All that piece and parcel of the land admeasuring about 1125 sq.ft. i.e. 104.55 sq.mtr. and RCC construction there on having Gat No.1193 Hissa No.1 at village Chikhali Tal. Haveli Dist. Pune within the local limits of Pimpri Chinchwad Municipal Corporation & within the jurisdiction of Sub-Registrar Haveli and is bounded as
 On or towards East : By Property of Mr. Sunil Londhe
 On or towards West : By Property of Mr. Ananda D. Gunjal.
 On or towards South : By 10 ft. Road
 On or towards North : By Property of Mr. Zaware

DATE: 08/07/2020
 PLACE : Pune.
 Sd/-
Meghanad S. Bodas
 Authorized Officer
 Prerana Co-Op Bank Ltd.

OSIL EXPORTS LIMITED
 (In Liquidation)
 Liquidator: Mr. Kanwal Goyal
 Registered Office: 80th Miles Stones, G.T. Road, Jattipur, Panipat, Haryana- 132103
 Email ID: assetsale@aaainsolvency.in; kanwal.goyal@aaainsolvency.com
 Contact No.:+91 8800865284 (Mr. Puneet Sachdeva/Raj Kumar)

E-Auction
 Date and Time of E-Auction: 30th July, 2020 at 11.00 am to 01.00 pm (With unlimited extension of 5 minutes each)

Sale of Assets and Properties owned by OSIL Exports Limited (in Liquidation) forming part of Liquidation Estate formed by the Liquidator, appointed by the Hon'ble National Company Law Tribunal, Chandigarh Bench vide order dated 17th October, 2019. The sale will be done by the undersigned through the e-auction platform <https://aaa.auctiontiger.net>.

Asset	Block	Floor Price (In Rs.)*	EMD Amount (In Rs.)	Incremental Value (In Rs.)
Plant & Machinery at 80th Miles Stones, G.T. Road, Jattipur, Panipat 132103	A	4.00 Cr	1 Laks	5 Laks
Stock and Inventory material (Yarn, Madup items, Fabric, Quills, Etc)	B	2.50 Cr	1 Laks	2 Laks
BMW 730 LD - Diesel - HR-60-D-3333 (2011)	C	10 lakhs	20 Thousand	20 Thousand
Mercedes Benz - Diesel - HR-60-A3041 (2006)	D	2.00 Lakhs	10 Thousand	10 Thousand
Tempo - HR-67-3638 and Hero Honda Splendor - HR-06-F-8468	E	15 Thousand	2 Thousand	1 Thousand
Air conditioners (Split)	F	15 Thousand	2 Thousand	1 Thousand
Plastic Crates and Pallets	G	3 Thousand	10 Thousand	10 Thousand
Scrap (Plastic-Iron+Carton)	H	2.50 lakhs	10 Thousand	10 Thousand
Computers	I	40 Thousand	5 Thousand	1 Thousand
Furniture and Fixtures	J	2.50 lakhs	10 Thousand	5 Thousand

*This is bidding starting price not a reserve price. The liquidator has a right to accept or reject the final bid. The bidder has no right to claim or enforce acceptance of any bid.

Terms and Condition of the E-Auction are as under

- E-Auction will be conducted on "AS IS WHERE IS", "AS IS WHAT IS" and "WHATSOEVER THERE IS BASIS" through approved service provider M/S E-Procurement Technologies Limited (Auction Tiger).
- The Complete E-Auction process document containing details of the Assets, online e-auction Bid Form, Declaration and Undertaking Form, General Terms and Conditions of online auction sale are available on website of AAA Insolvency Professionals LLP i.e. <https://insolvencyandbankruptcy.in/public-announcement/osil-exports-limited/> and Auction Tiger i.e. <https://aaa.auctiontiger.net>. Contact: Ms. Neha Gvani at +91-651896834/079-61200580 & 651896834 & neha.gvani@aaainsolvency.com / prasad@aaainsolvency.com / support@aaainsolvency.net (On going to the link <https://aaa.auctiontiger.net> interested bidders will have to search for the mentioned company by using either one of the two options, (i) Company's name (OSIL Exports Limited), or by, (ii) State and property type. The bidders may go through E-auction Process document thoroughly before bidding.
- The intending bidders are required to deposit Earnest Money Deposit (EMD) amount either through DD/NEFT/RTGS in the Account of "OSIL EXPORTS LIMITED IN LIQUIDATION", Account No. : 3013753204, Kotak Mahindra Bank Limited, Branch: G-5-13, Plot No. 182, Basement, Local Shopping Centre, Pampho Enclave, Greater Kailash I, New Delhi 110048, IFSC Code: KKBK000195, or through DD drawn on any Scheduled Bank in the name of OSIL EXPORTS LIMITED IN LIQUIDATION or give a Bank Guarantee for the EMD Amount as per Form A or Form B as given in the Complete E-Auction process document.
- The intending bidder should submit the evidence for EMD Deposit or Bank Guarantee and Request Letter for participation in the E-Auction along with Self attested copy of (1) Proof of Identification (2) Current Address-Proof (3) PAN card (4) Valid e-mail ID (5) Landline and Mobile Phone number (6) Affidavit and Undertaking, as per Annexure 1 (7) Bid Application Form as per Annexure II (8) Declaration by Bidder, as per Annexure III, the formats of these Annexures can be taken from the Complete E-Auction process document. These documents should reach the office of the liquidator or by e-mail, at the address given below before 7:00 PM of July 28, 2020. Interested bidders will have to upload their KYC documents along with the EMD submission details on <https://aaa.auctiontiger.net>.
- The Name of the Eligible Bidders will be identified by the Liquidator to participate in e-auction on the portal (<https://aaa.auctiontiger.net>). The e-auction service provider (Auction Tiger) will provide User id and password by email to eligible bidders.
- The bidding will start from a floor price, in case, a bid is placed in the last 5 minutes of the closing time of the e-auction, the closing time will automatically get extended for 5 minutes with unlimited extension. The bidder who submits the highest bid amount on closure of e-auction process shall be declared as the Successful Bidder and a communication to that effect will be issued through electronic mode which shall be subject to approval by the Liquidator. The highest bid does not entitle the bidder to claim as a successful bidder. The liquidator decision in this case would be final.
- If the H1 bidder is declared as the successful bidder by the liquidator and it would be communicated to successful bidder through email provided by bidder in the bid form and EMD of the Successful Bidder shall be retained towards part sale consideration and the EMD of unsuccessful bidders shall be refunded. The EMD shall not bear any interest. Thereafter, the liquidator will issue a Letter of Intent (LOI) to the Successful Bidder and the Successful Bidder shall have to deposit the balance amount (Successful Bid amount - EMD Amount) within 30 days on issuance of the LOI by the Liquidator. Default in deposit of the balance amount by the successful bidder within the time limit as mentioned in the LOI would entail forfeiture of the entire amount deposited (EMD + Any Other Amount) by the Successful Bidder.
- The Successful Bidder shall bear the applicable stamp duties/transfer charge, fees etc. and all the local taxes, duties, rates, assessment charges, fees etc. in respect of the property put on auction.
- The E-Auction may be cancelled by the Liquidator at any stage
- After payment of the entire sale consideration, the sale certificate/agreement will be issued in the name of the successful bidder only and will not be issued in any other name.
- The sale shall be subject to provisions of Insolvency and Bankruptcy Code, 2016 and regulations made thereunder.
- The liquidator shall provide all assistance necessary for the conduct of due diligence by interested buyers.
- E-auction date & Time: July 30, 2020 from 11.00 a.m. to 01.00 p.m. (with unlimited extension of 5 minutes)

Sd/-
Kanwal Goyal
 Liquidator
 OSIL Exports Limited in Liquidation
 IBBI Regn. No. IBBI/PA-002/IP-NO0007/2016-2017/10007
 Address: E-10A, Kailash Colony, Greater Kailash - I, New Delhi 110048
 Email ID: assetsale@aaainsolvency.in; kanwal.goyal@aaainsolvency.com
 Contact No. : 011 4666 4626; +91 8800865284
 Date: 11.07.2020
 Place: Delhi

Mangalore SEZ Limited
 Mangalore Special Economic Zone, Sy.No. 168-3A, Plot No. U1 Administrative Building, Bajpe Village, Mangalore - 574 142
 Dakshina Kannada, Karnataka

Extension of Tender Dates

The last date for issue of blank e-tender documents and deadline for uploading bids are extended as follows:

Name of work	Last date for issue of blank e-tender document		Deadline for submission of bids	
	Original	Revised	Original	Revised
Operation & Maintenance of Tertiary Treatment Plant of MSEL at Kavor, Mangalore for a period of 3 years - Contract Package No: MSEL/OGM/TP/2020	14.07.2020	30.07.2020	15:00 hrs on 15.07.2020	15:00 hrs on 31.07.2020

Please refer website www.tenderwizard.com/MSEL and www.mangaloresez.com for further details.

Sd/-, Chief Executive Officer
Mangalore SEZ Ltd, Mangaluru

SHAHNOL SILK INDUSTRIES LTD
 Corporate Office: 3rd Floor, Dawer Chambers, Nr.Sub Jail, Ring Road, SURAT 395002
 CIN: L17120GJ2008PLC053464
 Tel. no. : +91-261-4192020 Fax No. : +912635550 Website: www.shahnon.com

Extract of Standalone Audited Financial Results for the quarter and year ended 31st March, 2020 (₹ in Lacs)

Sr. No.	Particulars	Quarter ended		(Rupees in Lakhs) Year Ended	
		Audited	Unaudited	Audited	Audited
1	Total income from operations (net)	11443.47	7938.83	14586.73	38251.80
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-448.85	49.61	62.76	112.61
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	-448.85	49.61	62.76	112.61
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	-383.53	4.69	99.67	25.41
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	-267.68	4.69	119.02	141.25
6	Equity Share Capital (Face Value Rs.10/- per share)	1786.05	1786.05	1115.23	1786.05
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	6689.60	7296.67
8	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) - Basic:	-2.15	0.03	0.89	0.15
	Diluted:	-2.15	0.03	0.89	0.15

Notes:

- The above financial results have been reviewed by the Audit Committee and there after approved by the Board of Directors at its meeting held on 11th July, 2020.
- The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Year ended 31st March, 2020, filed with the stock exchanges under Regulations 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Financial Results is available on the Stock Exchange website (www.bseindia.com) and on Company's website (www.shahnon.com)

Date : 11-07-2020
 Place : Surat.
 For Shahnon Silk Industries Ltd.
 By Order of the Board
 Director

बैंक ऑफ बड़ोदा
Bank of Baroda
 (A Government of India Enterprise)

Guru Krupa Complex, Gat. No. 392/1, Chakan Talegaon Road, Mahalunge, Tal. Khed, Dist. Pune-410501.
 Mob. : 9152941242
 e-mail : DBMLUN@bankofbaroda.com

To,
 M/s. Swift Tools Proprietor Mrs. Ashwini Girish Chikhale
 Address : 1) F-25, Radha nagar Hsg. Society, Dighi Road, Bhosari, Pune.
 2) Shop No.10 A Plot 1133, Sector 7, Shivraj Indl. premises PCNTDA Bhosari, Pune.

Re.: Declaration of your account M/s. Swift Tools and its Proprietors Willful Defaulters and Opportunity for Representation there against.

We refer to our show cause notice dated 02.01.2020 for declaring M/s. Swift Tools and its proprietor as willful defaulter on the following grounds and paper publication made on 05.01.2020. Even after receipt of the unit has defaulted in meeting its payment / repayment obligations to the lender and has also sanctioned or removed the movable fixed assets or immovable property given for the purpose of securing a loan without the knowledge of the Bank.

As you are aware that our branch had sent the show cause notice referred above by registered post / speed post / courier on 02.01.2020, newspaper publication made on 05.01.2020 Even after receipt of the above referred show cause notices, we have not received any representation or response from you. In the light of the aforesaid facts and circumstances, after hearing the borrower and perusing the documents on record the Committee of Executives on Willful Defaulters (COE) of bank has decided to declare the M/s. Swift Tools as borrower and its proprietor Mrs. Ashwini Girish Chikhale as Willful Defaulters on the grounds mentioned in the show cause notice, after concluding that Borrower has closed activity and removed movable fixed assets without knowledge of the Bank.

In terms of RBI guidelines and to comply principles of natural justice, if you, desire, you may send your further submission / representation, if any, for consideration by the Review Committee on Willful Defaulters within-15 days from the date of receipt of this letter as to why your account and you be not classified by Bank as a Willful Defaulter.

Please note that, in case your further submission / representation against the intention of Bank to declare you as a Willful Defaulter is not received within-15 days from the date of receipt of this letter, it will be deemed that you have nothing to submit and the Bank will proceed further and classify your account as willful defaulter. Bank reserves the Right to publish the name and photograph of Willful Defaulter in News Paper and will initiate the necessary recovery action as per extant guidelines issued by Reserve Bank of India.

This communication is issued as per the directions of the Committee of Executives on Willful Defaulters (COE)

This is for your information.

Yours faithfully,
 Sd/-
 (Branch Manager)
Bank of Baroda

Date : 10.07.2020
 Place : Pune

CLASSIFIED CENTRES IN MUMBAI

Bejley Ads, Opera House
 Phone : 23672926 / 56051035.
Color Spot, Byculla (E)
 Phone : 23748048 / 23714748.
FCA Communications, Nariman Point
 Phone : 40020550 / 51.
Fulrani Advtg. & Mktg. Antop Hill, Fort
 Phone : 24159061
 Mobile: 9769238274 / 9969408855
Ganesh Advertising, Abdul Rehman Street
 Phone : 2422 9163 / 2341 4596.
J.K. Advertisers, Hornimal Circle, Fort
 Phone : 22663742.
Mani's Agencies, Mumbai Central
 Phone : 2263 00232.
 Mobile : 9892091257.
Manjot Ads, Curry Road (W)
 Phone : 982046338.
 Mobile : 9820640262.
OM Sai Ram Advtg, Curry Road
 Mobile: 9967375573
Pinto Advertising, Mazgaon
 Phone : 23701070.
 Mobile : 9869040181.
Premier Advertisers Mumbai Central
 Mobile: 9819891116
Sarjan Advertising, Tardeo
 Phone : 66626983